



ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોએ ઘરે રહેવાનો હુકમ જૂન 2 સુધી લંબાવ્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 13, 2021) – આજે, ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોએ ઘોષણા કરી કે તેઓ સમગ્ર પ્રોવિન્સને આવરી લેતો ઘરે રહેવાનો હુકમ (પ્રોવિન્સિયલ સ્ટે-એટ-હોમ ઓર્ડર) ઓછામાં ઓછો બુધવાર, જૂન 2, 2021 સુધી લંબાવી રહ્યાં છે.

જાહેર આરોગ્ય ઉપાયો

પ્રોવિન્સમાં કટોકટીની ઘોષણા અને ઘરે રહેવાનો હુકમ, બંને વધુ બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યા છે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળે. ઘરે રહેવાના હુકમમાં ગ્રોસરી સ્ટોર કે ફાર્મસીમાં ખરીદી કરવા જવું, આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવી, વ્યાયામ માટે અથવા અનિવાર્ય કામકાજ માટે બહાર જવું જેવા અનિવાર્ય હેતુઓના અપવાદો સિવાય દરેક વ્યક્તિએ ઘરે રહેવું અનિવાર્ય બને છે.

નીચેના જાહેર આરોગ્ય અને કાર્યસ્થળે સુરક્ષા ઉપાયો અમલમાં રહે છે:

- એક જ ઘરના સભ્યો સાથે હો અથવા ઘરની બહાર એકલી રહેતી અન્ય એક વ્યક્તિ અથવા ઘરના કોઈ સભ્ય માટે સંભાળકર્તા સિવાય, બધાં આઉટડોર સામાજિક મેળાવડા અને આયોજિત જાહેર પ્રસંગો કરવાનું પ્રતિબંધિત છે;
- બાંધકામ ક્ષેત્રમાં બધાં અનિવાર્ય-સિવાયના કાર્યસ્થળો બંધ રહે છે;
- સ્ટોરની અંદર રહીને ખરીદી કરવાની પરવાનગી આપી હોય તેવા બધાં રિટેઈલ સ્થળોમાં ક્ષમતા સીમા 25 ટકા સુધીની છે. આમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ વેચતા સુપરમાર્કેટ્સ, ગ્રોસરી સ્ટોર્સ, કન્વેનિયન્સ સ્ટોર્સ, ઈનડોર ફાર્મસી માર્કેટ્સ, અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે;
- બધી આઉટડોર રિક્રિએશનલ કોર્સ અને સ્પોર્ટ્સ મેદાનો, જેમ કે ગોલ્ફ કોર્સીસ, બાસ્કેટબોલ કોર્સ અને સોકર મેદાનો બંધ રહે છે; અને
- લગ્ન પ્રસંગો, અંતિમક્રિયાઓ, અને ધાર્મિક સેવાઓ, વિધિઓ કે ક્રિયાઓ ઈનડોર કે આઉટડોર 10 લોકો સુધી સીમિત કરવામાં આવી છે. આ સેવાઓ સાથે સંકળાયેલા સામાજિક મેળાવડા જેમ કે રિસેપ્શન્સ પર પ્રતિબંધ છે, એક જ ઘરમાં રહેતા સભ્યો સાથે અથવા ઘરની બહાર એકલી રહેતી અન્ય એક વ્યક્તિ સાથે હો તે સિવાય. ડ્રાઈવ-ઇન સેવાઓને પરવાનગી મળી છે.

[સમગ્ર પ્રોવિન્સને આવરી લેતી કટોકટી બ્રેક](#) (એટલે કે માત્ર કર્બસાઈડ પિક-અપ અને ડિલિવરી) હેઠળ અનિવાર્ય-સિવાયના રિટેઈલ માટે લાગુ અન્ય બધાં જાહેર આરોગ્ય અને કાર્યસ્થળે સુરક્ષા ઉપાયો ચાલુ રહેશે.

વધુ માહિતી [અહીં](#) વાંચો.

સીટી સર્વિસીસ અને ફેસિલિટીસ

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો માત્ર એપોઈન્ટમેન્ટથી રૂબરૂમાં સેવાઓ માટે ખુલ્લી છે. વોક-ઇન્સને પરવાનગી આપવામાં આવી નથી. એપોઈન્ટમેન્ટ બૂક કરાવવા, વેબસાઈટ જુઓ www.brampton.ca/skiptheline.

સીટી રિક્રિએશન સેન્ટર્સ અને આઉટડોર સગવડો

સીટી ઓફ બ્રેમ્પટનની બધી મનોરંજનલક્ષી સગવડો જાહેર જનતા માટે બંધ રહેશે અને ઈનડોર પ્રોગ્રામ્સ આગળ નોટિસ આપતા સુધી રદ રહેશે.



બધી આઉટડોર રિક્રિએશનલ કોર્ટ્સ અને સ્પોર્ટ્સ મેદાનો, જેમ કે ગોલ્ફ કોર્સીસ, બાસ્કેટબોલ કોર્ટ્સ અને સોકર મેદાનો બંધ છે; અને સ્મતના મેદાનો ખુલ્લા રહે છે.

ઉદ્યાનો અને રસ્તાઓ ખુલ્લા રહે છે. ચિંગકુસી પાર્ક અને અલડોરાડો પાર્કમાં વોશરૂમ સગવડો ઉપલબ્ધ છે.

વર્ચુઅલ પ્રોગ્રામ્સ

વર્ચુઅલ ફિટનેસ

રહેવાસીઓને તાલીમબદ્ધ શિક્ષકો સાથે 30-મિનિટના મફત લાઇવ વર્ચુઅલ ફિટનેસ વર્ગોમાં સહભાગી થવાનું નિમંત્રણ આપવામાં આવે છે.

55+ વર્કશોપ્સ

55 વર્ષ અને વધારે ઉંમરના બ્રેમ્પટનવાસીઓ પોતાના ઘરેથી વર્ચુઅલ વર્કશોપ્સ માટે મફતમાં નોંધણી કરાવી શકે છે અને ઓનલાઇન સત્રોમાં જોડાઈને પ્રવૃત્તમય રહી શકે છે. સહભાગીઓ પાસે સુરક્ષિત અને સંરચિત વાતાવરણમાં સોશિયલાઇઝ થવાની, નવા મિત્રો બનાવવાની અને ઓનલાઇન જોડાવાની તક રહેશે.

સર્વગ્રાહી વર્ચુઅલ પ્રવૃત્તિઓ અને વર્કશોપ્સ

આ શ્રેણી અશક્તતા ધરાવતા અને અપવાદમય સહભાગીઓ માટે પ્રવૃત્તિઓમાં જોડાવાની, કંઈક નવું શીખવાની અને સમોવડિયાઓ સાથે સ્થાયી મિત્રતા બનાવવાની ચડિયાતી તક છે.

નોંધણી કેવી રીતે કરવી તે સહિત, વર્ચુઅલ પ્રોગ્રામ ઓફર્સ સંબંધમાં વધુ માહિતી વેબસાઇટ [અહીં](#) જોઈ શકાય છે.

રેક એટ હોમ (Rec At Home)

ઘરે બેઠાં સ્વ-માર્ગદર્શક ઓનલાઇન આટર્સ અને કાફ્ટ ટ્યુટોરિયલ્સ સાથે સક્રિય અને પ્રવૃત્તમય રહો, 24/7 પહોંચ સુલભ! ઓરિગામી હાટર્સ બનાવવાની રીત શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બધાંનો મહાવરો કરો. વિવિધ રેક એટ હોમ પ્રવૃત્તિઓમાં [અહીંથી](#) પ્રવેશો, તેને બ્રેમ્પટન રિક્રિએશને પ્રેમપૂર્વક બનાવી છે.

મેન્ડેટરી ફેસ કવરિંગ્સ

મેન્ડેટરી ફેસ કવરિંગ્સ બાય-લો હેઠળ, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માસ્ક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવા અનિવાર્ય છે. જાહેર સંસ્થાઓ અને ધંધાઓએ પોતાના નિયંત્રણ હેઠળની ઈનડોર જાહેર જગ્યાઓમાં માસ્ક્સ કે ફેસ કવરિંગ્સ પહેરવામાં આવતા હોવાની ખાતરી કરવી અનિવાર્ય છે.

આ બાય-લો (પેટા-કાનૂન) મુક્તિ આપે છે, તબીબી કારણોસર માસ્ક કે ફેસ કવરિંગ ના પહેરી શકે તેવી વ્યક્તિઓ સહિતની ચોક્કસ વ્યક્તિઓને; બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને; કટોકટી હુકમો અનુસાર અથલેટિક (કસરતી) પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય લોકોને. વધુ માહિતી માટે વેબસાઇટ જુઓ: www.brampton.ca/masks.

રહેવાસીઓ અને ધંધાઓ વધુ માહિતી અને સર્વિસ વિનંતીઓ માટે 311 નંબર પર કોલ કરી શકે છે, વેબસાઇટ www.311brampton.ca જોઈ શકે છે અથવા 311 મોબાઇલ એપનો ઉપયોગ કરી શકે છે.



રસીકરણ (વેક્સિનેશન્સ)

18 વર્ષ ઉપરના બધાં બ્રેમ્પટનવાસીઓ હવે પોતાની COVID-19 રસી મેળવવા એપોઈન્ટમેન્ટ બુક કરાવવાને પાત્ર છે. COVID-19 રસીકરણ પર સૌથી અદ્યતન માહિતી માટે અને એપોઈન્ટમેન્ટ બુક કરાવવા, પ્રોવિન્સનું [વેક્સિન પોર્ટલ](#) જુઓ.

લિંક્સ (કડીઓ)

વધુ માહિતી મેળવો:

- [સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 પ્રોગ્રામિંગ અને સર્વિસ અપડેટ્સ](#)
- [સીટી ઓફ બ્રેમ્પટન – શું ખુલ્લું છે, શું બંધ છે](#)
- [COVID-19 નાં લક્ષણો](#)
- [COVID-19 વેક્સીન \(રસી\)](#)
- [બ્રેમ્પટનમાં ટેસ્ટિંગ](#)
- [સેલ્ફ-આઈસોલેટ કેવી રીતે થવું](#)
- [COVID-19 દરમિયાન ધંધાઓ અને કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા](#)
- [પીલમાં COVID-19 નાં કેસીસ](#)

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca